

રાજકોટ મહાનગરપાલિકા - આરોગ્ય શાખા - મેલેરિયા વિભાગ



સ્વચ્છ
સર્વેક્ષણ
2022

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ
ડૉ. આંબેડકરભાવન રૂમ નં. ૬, ત્રીજો માળ, બસ સ્ટેન્ડની પાસે,
દેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૨.

☎ : 0281 - 2237062

✉ : biologist_rmc@yahoo.in

👍 Like us on Facebook : /malaria.department

તા.૩૦/૧/૨૦૨૩

-: અખબાર યાદી :-

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૨૩/૦૧/૨૩ થી તા.૨૯/૦૧/૨૩) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અપનાવવું.

ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા યોખમા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છર જન્ય રોગો	અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૨૩/૦૧/૨૩ થી તા.૨૯/૦૧/૨૩)	તા.૦૧/૦૧/૨૦૨૩ થી વર્ષમાં કુલ નોંધાયેલ
મેલેરિયા	૧	૩
ડેન્ગ્યુ	૧	૩
ચિકુનગુનિયા	૦	૨

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૨૩/૦૧/૨૩ થી તા.૨૯/૦૧/૨૩)

ક્રમ	વિગત	કેસની સંખ્યા	તા.૦૧/૦૧/૨૦૨૩ થી વર્ષમાં કુલ નોંધાયેલ
૧	શરદી - ઉધરસના કેસ	૪૩૬	૧૩૯૬
૨	સામાન્ય તાવના કેસ	૪૫	૧૭૯
૩	ઝાડા - ઉલટીના કેસ	૬૯	૩૨૭
૪	ટાઈફોઈડ તાવના કેસ	૦	૦
૫	કમળો તાવના કેસ	૦	૦
૬	મરડાના કેસ	૦	૦

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૩/૦૧/૨૩ થી તા.૨૯/૦૧/૨૩ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ ૫,૭૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૬૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ મહાત્મા ગાંધી પ્લોટ, ખોડીયારનગર, શ્રી વસુંધરા રેસીડેન્સી, કેનાલ રોડ, નારાયણનગર, નારાયણનગર ઝુપડપટ્ટી, રજપુતપરા શેરી નં. ૨ થી ૪, માટેલ પાર્ક સોસા., સ્વામીનારાયણ પાર્ક, કિશાનપરા, સોરઠીયા વાડી, લલુડી વોક્ષી વિસ્તાર, આસોપાલવ એલીગંસ કણકોટ રોડ , વિનસ પાર્ક, લોહાણા ચાલ, જંકશન પ્લોટ શેરી ૧૫ અને મેઈન રોડ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્જ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૨૬૮ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંક માં ૧૦૮ અને કોર્મશીયલ ૧૧ આસામીને નોટીસ આપવામાં આવેલ છે.

ડેન્જ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અપનાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યક્તિઓ સુધી પહોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આપને તેમજ આપના પરિવારને ડેન્જ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્જ્યુ મેલેરિયા અટકાયતી માટે આટલું જરૂરી કરીએ.

- (૧) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાયુસ્ત ઢાંકીને રાખીએ. હવાયુસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાયુસ્ત ઢાંકીને રાખીએ.
- (૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
- (૩) ફિજની ટ્રે, માટલા, કુલર, કુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.
- (૪) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
- (૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
- (૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ.
- (૭) ડેન્જ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમિયાન પુરૂ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

યાદ રાખો... આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુક્ત રાજકોટ

આરોગ્ય અધિકારી
રાજકોટ મહાનગરપાલિકા